

August 12, 2020

To,
Corporate Relationship Department
BSE Limited
14th Floor, P. J. Towers,
Dalal Street, Fort,
Mumbai-400 001
SCRIP CODE: 532779

To,
Listing Department,
National Stock Exchange of India Limited
"Exchange Plaza", C – 1, Block G
Bandra- Kurla Complex, Bandra (East),
Mumbai 400 051
SYMBOL: TORNTPOWER

Dear Sir/Madam,

Re: News Paper Advertisement for NCLT convened meetings of Equity Shareholders, Secured Creditors of Torrent Power Limited and Unsecured Creditors of Cable Business Undertaking only of Torrent Power Limited

Pursuant to the Regulations 30 of SEBI (Listing Obligations and Disclosure Requirements) Regulations, 2015 read with Orders dated July 21, 2020 and June 30, 2020 (collectively referred to as 'Orders') of Hon'ble National Company Law Tribunal, Ahmedabad Bench ('NCLT') we enclose herewith copies of newspaper advertisement published today in 'The Indian Express' English (Ahmedabad and Vadodara Editions) and 'Sandesh' Gujarati (Ahmedabad Edition), having electronic editions, intimating that NCLT convened meetings of Equity Shareholders, Secured Creditors of the Company and Unsecured Creditors of Cable Business Undertaking of the Company, are scheduled to be held on Tuesday, September 15, 2020 through Video Conferencing or Other Audio Visual Modes, to consider and if thought fit, to approve the proposed Scheme of Arrangement between Torrent Power Limited (hereinafter referred to as the "Transferor Company") and TCL Cables Private Limited (hereinafter referred to as the "Transferee Company") and their respective shareholders and creditors for transfer and vesting of the Cable Business Undertaking of Torrent Power Limited to TCL Cables Private Limited by way of slump sale, under Sections 230-232 and other applicable provisions of the Companies Act, 2013.

This is for your information and record.

Thanking you,

Yours faithfully,

For Torrent Power Limited

RAHUL
CHAITANYA
BHAI SHAH
Digitally signed by
RAHUL
CHAITANYABHAI
SHAH
Date: 2020.08.12
15:18:58 +05'30'

Rahul Shah

Company Secretary & Compliance Officer

Encl: As above

astron
PAPER & BOARD MILL

Reg Office: D-702, 7th Floor Ganesh Meridian, Opp. High Court, S.G. Highway, Ahmedabad - 380060
Tel: (079) 40081221, Fax: (079) 40081220, CN: L2108032010PL, C063428
Web: www.astronpaper.com, Mail: cs@astronpaper.com

Extract of Un-audited Consolidated Financial Results for the Quarter ended 30th June, 2020.

Sr. No.	Particulars	(Rs. In Lakhs)		
		Quarter Ended on	Previous Year Ended on	Corresponding Quarter Ended
		30.06.2020	31.03.2019	30.06.2019
1	Revenue from Operations	6172.06	36027.67	8285.51
2	Net Profit for the period (before tax, Exceptional and/or Extraordinary Items)	237.76	1979.89	706.18
3	Net Profit for the period before tax (after Exceptional and/or Extraordinary Items#)	237.76	1979.89	706.18
4	Net Profit for the period after tax (after Exceptional and/or Extraordinary Items#)	183.49	1341.99	498.56
5	Net Profit for the period after tax (after non controlling interest, share of profit / (loss) of joint venture and other comprehensive income (after tax))	-	-	-
6	Total Comprehensive Income for the period (Comprising Profit/(Loss) for the period (after tax) and Other Comprehensive Income (after tax))	183.49	1341.99	498.56
7	Paid up Equity Share Capital (F.V of Rs. 10/- each)	4650.00	4650.00	4650.00
8	Other Equity	-	11921.93	-
9	Earnings Per Share (F.V of Rs. 10/- each) (for continuing and discontinued operations)			
	1. Basic:	0.39	2.89	1.07
	2. Diluted:	0.39	2.89	1.07

Note: The above is an extract of the detailed format of Un-audited Standalone and Consolidated Financial Results for the Quarter ended 30th June, 2020 filed with the stock exchanges under Regulation 33 of the SEBI (LODR) Regulations, 2015. The full format of the Standalone and Consolidated Financial Results for the Quarter ended on 30th June, 2020 are available on the stock exchange website (www.nseindia.com and www.bseindia.com) and on the company's website (www.astronpaper.com)

For, ASTRON PAPER AND BOARD MILL LIMITED
Date : 11th August, 2020
Place : Ahmedabad

Shr Khrh Patel,
Chairman & Managing Director
Dile: 62326884

JINDAL HOTELS LTD.
Regd. Office : Grand Mercure Vadodra Surya Palace, Sayajigunj, Vadodra - 390 020.
CIN No : L18119GJ1984PLC069822, T: 0265-2363366, Fax: 2363388
Website: www.suryapalace.com, E: share@suryapalace.com

STATEMENT OF UNAUDITED FINANCIAL RESULTS FOR THE QUARTER ENDED 30.06.2020

Particulars	(Rs. in Lakhs)		
	For the quarter ended 30th June, 2020	For the quarter ended 30th June, 2019	For the year ended 31st March, 2020
Revenue from Operations	64.17	833.60	3,781.39
Net Profit/(Loss) for the period (before Tax, Exceptional and/or Extraordinary Items)	(386.83)	(38.72)	105.80
Net Profit/(Loss) for the period before tax (after Exceptional and/or Extraordinary Items)	(386.83)	(38.72)	105.80
Net Profit/(Loss) for the period after tax (after Exceptional and/or Extraordinary Items)	(374.64)	(24.78)	87.93
Total Comprehensive Income for the period (comprising Profit/(Loss) for the period (after tax) and Other Comprehensive Income (after tax))	(0.87)	0.90	(3.48)
Equity Share Capital	600.00	600.00	600.00
Reserves (excluding Revaluation Reserve) as shown in the Audited Balance Sheet of the previous year	-	-	-
Earnings Per Share (of Rs.10/- each) Basic & Diluted (Rs.)	(6.24)	(0.41)	1.13

Note: The above is an extract of the detailed format of 1st Quarter ended Unaudited Financial Results filed with BSE on 31 of SEBI (Listing Obligations and Disclosure Requirements) Regulations, 2015. The full format of the Quarterly Financial Results is available on the Company's website at www.jindalhotels.com and the BSE website www.bseindia.com.

2. The above audited results have been reviewed by the Audit Committee and approved by Board of Directors in their meeting held on 11.08.2020.

Notice is hereby given that the 35th Annual General Meeting of the Members of Jindal Hotels Limited will be held on **Thursday, 10th September, 2020 at 12:30 pm. IST** through Video Conferencing ("VC") (Other Audio Visual Means ("OAVM")) "UPDATING EMAIL ADDRESSES, MOBILE NUMBER & BANK MANDATE OF SHAREHOLDERS. This will facilitate the Company for sending Annual Report, Notice of General Meeting and any other important communications through electronically in compliance to MCA & SEBI General Circulars in view of COVID-19. Those members who have not registered their E-mail id may kindly register with their DP/ID shares held in demat mode) or RTA, Link in time India Pvt Limited at www.linkintime.co.in and/or Investor Service > Email/Bank detail Registration. Fill in the details, upload the required documents and submit. In addition to this shareholders are also requested to update their Bank Mandate and opt for receiving any future/unclaimed dividends through electronic mode." For any clarification please send email to company: share@suryapalace.com

Date : 11th August, 2020
Place : Vadodra

For Jindal Hotel Ltd.
Piyush D. Shah (Managing Director)

Aspire Home Finance Corporation Limited
Corporate Office: Medhi Oval Tower, Rahmatabad Sagar Road, Opposite ST Depot, Paldi, Mumbai - 400025.
Email : info@aspire.com, CN Number : U69923MH2013PLC248741
Branch Office : Office No. 1026 & 1027, 1st Floor, World Trade Centre, Nc, Udhna Dargaja, Ring Road, Surat - 395002, Gujarat
Gentel No: 02698888888, 02698888888

PUBLIC NOTICE FOR AUCTION CUM SALE

Pursuant to taking possession of the secured asset mentioned hereunder by the Authorized Officer of Aspire Home Finance Corporation Limited under the Securitization and Reconstruction of Financial Assets and Enforcement of Security Interest Act, 2002 for the recovery of loan, the following offers are invited by the undersigned in sealed covers for purchase of immovable property, as described hereunder, which is in the physical possession, on "As Is Where is Basis", "As Is What is Basis" and "Whatever is There is Basis". Particulars of which are given below:

Borrower(s)/Co-Borrower(s)/ Guarantor(s)	Demand Notice Date and Amount	Description of the Immovable property	Reserve Price (RP)	Earliest Money Dropoff (EMD) (10% of RP)
Loan Agreement No. LXSR00316-170023217 (Bural Branch) ROHITKUMAR VALBHAI BHAI THUMMAR (Borrower) RASVANTI ROHITBHAI THUMMAR (Co-Borrower)	24-03-2019 for Rs. 128800/- (Rupees Twelve Lac Eighty Eight Thousand Five Only)	Plot No. 219, Shradha Residency, Kudsad, Near Kim Fakal, Block No. 739, Opad, Surat - 394327 Gujarat	Rs. 80000/- (Rupees Eighty Thousand Only)	Rs. 8000/- (Rupees Eight Thousand Only)
Loan Agreement No. LXSR00416-170029727 (Bural Branch) JAYSUKHBIHAI MANJIBHAI BED (Borrower) JATIN JAYSUKHBIHAI BED (Co-Borrower)	14-08-2019 for Rs. 148922/- (Rupees Fourteen Lac Eighty Nine Thousand Two Hundred Twenty Five Only)	Plot No. 220, Shradha Residency, Near Kim Fakal, Block No. 739, Opad, Kudsad, Surat, Near Kim Fakal, Surat - 394410	Rs. 80000/- (Rupees Eighty Thousand Only)	Rs. 8000/- (Rupees Eight Thousand Only)

- Last Date of Submission of Sealed Bid/ Offer in the prescribed tender forms along with EMD and KYC is 14-09-2020 within 11:00 AM at the Branch Office address mentioned herein above. Tenders that are not filed up or tenders received beyond last date will be considered as invalid tender and shall accordingly be rejected. No interest shall be paid on the EMD.
- Date of Opening of the Bid/Offer (Auction Date) for Property is 14-09-2020 at the above mentioned branch office address at 3:00 PM. The tender will be opened in the presence of the Authorized Officer.
- Date of Inspection of the Immovable Property is on 20-08-2020 between 11:30 AM to 04:00 PM.
- Further interest will be charged as applicable, as per the Loan Agreement on the amount outstanding in the notice and incidental expenses, costs, etc., is due and payable immediately.
- The notice is hereby given to the Borrowers and Guarantors, to remain present personally at the time of sale and they can bring the intending buyers/purchasers for purchasing the immovable property as described herein above, as per the particulars of Terms and Conditions of Sale.
- The Borrower(s)/Guarantor(s) are hereby given 30 DAYS SALE NOTICE UNDER THE SARFAESI ACT, 2002 to pay the sum mentioned as above before the date of Auction failing which the immovable property will be auctioned and balance, if any, will be recovered with interest and costs. If the Borrower pays the amount due to Aspire Home Finance Corporation Ltd., in full before the date of sale, auction is liable to be stopped.
- The detail terms and conditions of the auction sale are incorporated in the prescribed tender form. Tender forms are available at the above mentioned Branch office.
- The immovable properties will be sold to the highest tenderer. However, the Authorized Officer reserves the absolute discretion to allow or reject any bid, if deemed necessary. The Property as mentioned will not be sold below Reserve Price.
- The Authorized Officer is not bound to accept highest bid offer and the Authorized Officer has the absolute rights to accept or reject any offer of the bid at any point of time and also has the right to adjourn/postpone/cancel the auction sale or conduct re-auction without assigning any reason therefor.
- AHFC is not responsible for any liabilities whatsoever pending upon the property as mentioned above. The Property shall be auctioned on "As Is Where is Basis", "As Is What is Basis" and "Whatever is There is Basis".
- The Total Loan Outstanding amount is not the loan foreclosure amount. All other charges (if any) shall be calculated at the time of closure of the loan.
- The Demand Draft Should be made in favor of "Aspire Home Finance Corporation Limited" Only.
- The same has been published in our portal - <https://medhiabank.com/auction-portal/>

For further details, contact the Authorized Officer, at the above mentioned Office address.

Sd/-
Authorized Officer
For Aspire Home Finance Corporation Ltd.

Date : 12-08-2020
Place : Gujarat

BEFORE THE NATIONAL COMPANY LAW TRIBUNAL
AHMEDABAD BENCH
CA (CAA) NO. 35 of 2020
In the matter of the Companies Act, 2013;
AND
In the matter of Sections 230 to 232 and other applicable provisions of the Companies Act, 2013;
AND
In the matter of Scheme of Arrangement involving transfer and vesting of the Cable Business Undertaking of Torrent Power Limited to TCL Cables Private Limited.

TORRENT POWER LIMITED
(CIN L31200GJ2004PLC044068)
a Company incorporated under the Companies Act, 1956, and having its registered office at "Samanvay", 600 Tapovan, Ambawadi, Ahmedabad- 380015 in the state of Gujarat.Applicant Transferor Company

NOTICE OF MEETINGS OF EQUITY SHAREHOLDERS, SECURED CREDITORS, OF TORRENT POWER LIMITED AND UNSECURED CREDITORS OF ONLY THE CABLE BUSINESS UNDERTAKING OF TORRENT POWER LIMITED, THE APPLICANT TRANSFEROR COMPANY.

NOTICE is hereby given that by Orders dated July 21, 2020 and June 30, 2020 (collectively referred to as 'Orders'), the Hon'ble National Company Law Tribunal, Ahmedabad Bench ("NCLT") has directed separate meetings of all Equity Shareholders and Secured Creditors of Torrent Power Limited ("the Applicant Transferor Company" or "the Company") and Unsecured Creditors of only the Cable Business Undertaking ("Unsecured Creditors") of the Applicant Transferor Company for the purpose of considering, and if thought fit, approving, the Scheme of Arrangement involving transfer and vesting of the Cable Business Undertaking of Applicant Transferor Company to TCL Cables Private Limited ("Transferee Company" or "TCPL").

In pursuance of the said Orders read with general circular issued by Ministry of Corporate Affairs ("MCA") viz. circular no. 14 of 2020 dated April 08, 2020, circular no. 17 of 2020 dated April 13, 2020 and circular no. 20 of 2020 dated May 05, 2020 (collectively referred to as "MCA Circulars"), further notice is hereby given that meetings of all Equity Shareholders, Secured Creditors and Unsecured Creditors of the Applicant Transferor Company will be held through Video Conferencing ("VC") or Other Audio Visual Means ("OAVM") without the physical presence at common venue, as under:

Sr. No	Class of Meetings	Date of Meetings	Time (IST)
1.	Equity Shareholders	Tuesday, September 15, 2020	9.30 am
2.	Unsecured Creditors		11.00 am
3.	Secured Creditors		2.00 pm

Copies of the said Scheme of Arrangement, Explanatory Statement pursuant to Section 102 read with Sections 230 to 232 of the Companies Act, 2013 ("the Act") can be obtained free of charge from the registered office of the Applicant Transferor Company and / or from the office of the Advocate Mrs. Swati Soparkar at 301, Shivahik 10, Opp. SBI Zonal Office, Near Excise Chowky, S.M. Road, Ahmedabad 380015, Gujarat during normal business hours (9:30 am to 6:30 pm) from Monday to Friday only and including the date of the meeting. Pursuant to the said Orders read with MCA Circulars, voting at the above meetings shall not be permitted through proxies.

NCLT has appointed Shri Mahesh C. Gupta, an independent practicing Company Secretary and failing him Shri Ullas Shah, Chartered Accountant, to act as the Chairman of the said meetings including any adjournment thereof.

The Scheme of Arrangement, if approved in the aforesaid meetings, will be subject to the subsequent approval of other regulatory authorities and sanction by NCLT.

FURTHER NOTICE is hereby given that:

- Pursuant to NCLT Orders read with MCA Circulars and provisions of Section 108 of the Act read with Rule 20 of the Companies (Management and Administration) Rules, 2014 and Regulation 44 of the SEBI (Listing Obligations and Disclosure Requirements) Regulations, 2015 the business as set out in notices for aforesaid meetings be transacted through e-voting means by way of remote e-voting facility and e-voting facility during the meetings. The Company is providing facility for remote e-voting and e-voting during the meeting through Central Depository Services (India) Limited ("CDSL"). The necessary instructions for remote e-voting and e-voting during meetings have been set out in the notices dated July 27, 2020. This facility is being provided to the Equity Shareholders holding shares in physical and dematerialised form, Secured Creditors and Unsecured Creditors, as on cut-off date i.e. September 08, 2020.
- Notice of the aforesaid meetings inter alia including the Explanatory Statement, e-voting instructions and login credentials, wherever applicable has been emailed to the Equity Shareholders, Secured and Unsecured Creditors of Applicant Transferor Company as on March 31, 2020 and June 30, 2020, whose email addresses are registered with the Company or with the Depository Participants, as the case may be. For Equity Shareholders, Secured and Unsecured Creditors who have not registered their email addresses with the Company, physical copies have been sent by courier at their registered addresses.
- The aforesaid Notices alongwith the requisite documents are also available on the website of the Applicant Transferor Company at www.torrentpower.com, websites of the Stock Exchanges i.e. BSE Limited and National Stock Exchange of India Limited at www.bseindia.com and www.nseindia.com respectively and on the website of CDSL at www.evotingindia.com.
- Equity Shareholders, Secured and Unsecured Creditors who have not registered their email addresses with the Company / Depository Participants, may follow the process detail below for registration of their email address:

E-mail address registration process for Equity Shareholders

Physical Holding	By following the below link, Equity Shareholders may register his / her email address, mobile number and bank details https://linkintime.co.in/EmailReg/Email_Register.html After that Equity Shareholders have to fill the relevant details in the respective fields and attach self attested copy of PAN, address proof / share certificate and cancelled cheque leaf.
Demat Holding	By following the below link, Equity Shareholders may register his / her email address and mobile number https://linkintime.co.in/EmailReg/Email_Register.html For registration of bank details Shareholders are requested to visit their respective Depository Participants.

E-mail address registration process for Secured and Unsecured Creditors

Creditors may request for email registration alongwith their name, address, mobile number, PAN, Amount due from the Company at cs@torrentpower.com .

- For the aforesaid meetings of Equity Shareholders, Secured and Unsecured Creditors, the remote e-voting commences on **Friday, September 11, 2020 at 9:00 am (IST) and shall end on Monday, September 14, 2020 at 5:00 pm (IST)**. Thereafter, remote e-voting module shall be disabled by CDSL.
- The voting right of Equity Shareholders shall be in proportion to value of fully paid equity shares of the Applicant Transferor Company held by them as on September 08, 2020 being the cut-off date.
- The voting rights as well as value of vote of the Secured and Unsecured Creditors shall be in proportion to outstanding amount due to them by the Applicant Transferor Company as on September 08, 2020 being the cut-off date.
- Any person who becomes a Shareholder / Secured and Unsecured Creditors of the Applicant Transferor Company after dispatch of the Notice and holds shares / have outstanding due to them by Applicant Transferor Company as on the cut-off date may cast their votes by following the instructions of remote e-voting and e-voting during the meeting provided in the Notice. Login credentials for voting and attending the meeting through VC / OAVM will be sent separately to those Secured and Unsecured Creditors whose names are appearing in books of the Applicant Transferor Company as on cut-off date and to whom the same has not been sent earlier. Creditors who have not received login credentials may contact Company at cs@torrentpower.com or call +91 79 26628300.
- Those Equity Shareholders / Secured and Unsecured Creditors, who will be present in the meeting through VC / OAVM facility and had not casted their votes through remote e-voting and are otherwise not barred from doing so, shall be eligible to vote through e-voting system available during the meetings.
- Shareholder / Secured and Unsecured Creditors may attend the meetings even after exercising their right to vote through remote e-voting but cannot vote again during the meetings.
- As per NCLT Orders, M/s. Rajesh Parekh & Co., Practicing Company Secretaries have been appointed as the Scrutinizer to scrutinise e-voting during the meetings and through remote e-voting in a fair and transparent manner. The Scrutinizer will make a consolidated Scrutinizer's Report of the total votes cast in favour and against the resolution and invalid votes, if any, to the Chairman of the meeting, in writing, who shall countersign the same.
- The results of the meeting alongwith Scrutinizer's Report would be displayed at the Registered Office of the Applicant Transferor Company and on its website at www.torrentpower.com, on the website of the stock exchanges where the Applicant Transferor Company's securities are listed and on the website of CDSL.
- In case of any grievance connected with remote e-voting and e-voting during the meeting, the Equity Shareholders, Secured and Unsecured Creditors may contact Rakesh Dalvi- 022-23058542, Niin Kunder - 022-23058738 and Mehboob lakhani - 022-23058543 or send an email to helpdesk.evoting@cdslindia.com or call 1800225533.
- In order to express their views and to seek explanations pertaining to Scheme of Arrangement during the meeting, the concerned Shareholder, Secured and Unsecured Creditors are requested to register themselves as Speaker at least 7 days prior to meetings by sending their name, email id, mobile number, DP Id and Client Id / Folio no. at cs@torrentpower.com.

Mahesh C Gupta
FCS: 2047
CP No: 1028
Chairman appointed for the Meetings

Place : Ahmedabad
Date : August 11, 2020

astron
PAPER & BOARD MILL

Reg Office: D-702, 7th Floor Ganesh Meridian, Opp. High Court, S.G. Highway, Ahmedabad - 380006
Tel: (079) 40081221, Fax: (079) 40081220 CIN: L21990GJ2010PLC063428
Website: www.astronpaper.com Mail: cs@astronpaper.com

Extract of Un-audited Consolidated Financial Results for the Quarter ended 30th June, 2020.

Sr. No.	Particulars	(Rs. In Lakhs)		
		Quarter Ended on 30.06.2020	Previous Year Ended on 31.03.2020	Corresponding Quarter Ended on 30.06.2019
1	Revenue from Operations	6727.06	36027.67	8285.51
2	Net Profit for the period (before tax, Exceptional and/or Extraordinary Items)	237.76	1979.89	706.18
3	Net Profit for the period before tax (after Exceptional and/or Extraordinary Items)	237.76	1979.89	706.18
4	Net Profit for the period after tax (after Exceptional and/or Extraordinary Items)	183.49	1341.99	498.56
5	Net Profit for the period after tax (after non controlling Interest, share of profit / (loss) of joint venture and other comprehensive income (after tax))	-	-	-
6	Total Comprehensive Income for the period (Comprising Profit/(Loss) for the period (after tax) and Other Comprehensive Income (after tax))	183.49	1341.63	498.56
7	Paid up Equity Share Capital (F.V. of Rs. 10/- each)	4650.00	4650.00	4650.00
8	Other equity	-	1192.93	-
9	Earnings Per Share (F.V. of Rs. 10/- each) (for continuing and discontinued operations)			
	1. Basic:	0.39	2.89	1.07
	2. Diluted:	0.39	2.89	1.07

Note: (Rs. In Lakhs)

1. Additional Information on Standalone Financial Results for the Quarter ended 30th June, 2020 are as under:

Sr. No.	Particulars	For the quarter ended 30.06.2020	For the quarter ended 30.06.2019	For the quarter ended 30.06.2019
1	Revenue from operations	6727.06	36051.77	8285.51
2	Profit before Tax	376.02	2039.96	692.38
3	Profit after Tax	262.38	1350.89	535.83

Note: The above is an extract of the detailed format of Un-audited Standalone and Consolidated Financial Results for the Quarter ended 30th June, 2020 filed with the stock exchanges under Regulation 33 of the SEBI (LODR) Regulations, 2015. The full format of the Standalone and Consolidated Financial Results for the Quarter ended 30th June, 2020 are available on the stock exchange website (www.nseindia.com and www.bseindia.com) and on the company's website (www.astronpaper.com)

For, **ASTRON PAPER AND BOARD MILL LIMITED**
Date: 11th August, 2020
Place: Ahmedabad
Shri Kirti Patel,
Chairman & Managing Director
DIN: 02352684

JINDAL HOTELS LTD.
Regd. Office : Grand Mercure Vadodara Surya Palace, Sayajigunj, Vadodara - 390 020.
CIN No. : L18119GJ1984PLC006922. T: 0265-2363365, Fax: 2363388
Website: www.suryapalace.com, E: share@suryapalace.com

STATEMENT OF UNAUDITED FINANCIAL RESULTS FOR THE QUARTER ENDED 30.06.2020

Particulars	(Rs. In Lakhs)		
	For the quarter ended 30th June, 2020	For the quarter ended 30th June, 2019	For the year ended 31st March, 2020
Revenue from Operations	64.17	833.60	3,791.39
Net Profit/(Loss) for the period (before Tax, Exceptional and/or Extraordinary Items)	(386.83)	(38.72)	105.89
Net Profit/(Loss) for the period before tax (after Exceptional and/or Extraordinary Items)	(386.83)	(38.72)	105.89
Net Profit/(Loss) for the period after tax (after Exceptional and/or Extraordinary Items)	(374.64)	(24.78)	67.93
Total Comprehensive Income for the period (Comprising Profit/(Loss) for the period (after tax) and Other Comprehensive Income (after tax))	(0.87)	0.90	(3.48)
Equity Share Capital	600.00	600.00	600.00
Reserves (excluding Revaluation Reserve) as shown in the Audited Balance Sheet of the previous year	-	-	-
Earnings Per Share (of Rs.10/- each) Basic & Diluted (Rs.)	(6.24)	(0.41)	1.13

Notes:

1. The above is an extract of the detailed format of 1st Quarter ended Unaudited financial Results filed with BSE of 33 of SEBI (Listing Obligations and Disclosure Requirements) Regulations, 2015. The full format of the Quarterly Financial Results is available on the Company's website at www.suryapalace.com and the BSE website www.bseindia.com.

2. The above audited results have been reviewed by the Audit Committee and approved by Board of Directors in their meeting held on 11.08.2020.

Notice is hereby given that the 35th Annual General Meeting of the Members of Jindal Hotels Limited will be held on Thursday, 10th September, 2020 at 12:30 pm. IST through Video Conferencing ("VC") / Other Audio Visual Means ("OAVM"). "UPDATING EMAIL ADDRESSES, MOBILE NUMBER & BANK MANDATE OF SHAREHOLDERS". This will facilitate the Company for sending Annual Report, Notice of General Meeting and any other important communications through electronically in compliance to MCA & SEBI General Circulars in view of COVID-19. Those members who have not registered their E mail id may kindly register with their DP/IF shares held in demat mode or RTA, Link in time India Pvt Limited at www.linkintime.co.in under Investor Services > Email/Bank detail Registration - fill in the details, upload the required documents and submit. In addition to this shareholders are also requested to update their Bank Mandate and opt for receiving any future unclaimed dividends through electronic mode. For any clarification please send email to company: share@suryapalace.com

For Jindal Hotel Ltd.
Date : 11th August, 2020
Place : Vadodara
Piyush D. Shah (Managing Director)

Aspire Home Finance Corporation Limited
Corporate Office: Motilal Oswal Tower, Rahmatabhawan Savay Road, Opposite ST Depot, Prabhadevi, Mumbai-400025.
Email: info@ahfc.com, CIN Number: U65923MH2012PLC248741
Branch Office : Office No. 1026 & 1027, 1st floor, World Trade Centre, N. Udaipur Bypass, Ring Road, Surat - 395002, Gujarat
Contact No. Bhaskarumar Patel - 9827706599

PUBLIC NOTICE FOR AUCTION CUM SALE

Pursuant to taking possession of the secured asset mentioned hereunder by the Authorized Officer of Aspire Home Finance Corporation Limited under the Securitization and Reconstruction of Financial Assets and Enforcement of Security Interest Act, 2002 for the recovery of amount due from borrower(s), are invited by the Underwriter to sealed covers for purchase of Immovable property, as described hereunder, which is in the physical possession, on "As Is What Is Basis", "As Is What Is Basis" and "Whatever There Is Basis", particulars of which are given below:

Borrower's (Co-Borrower's)/ Guarantor(s)	Demand Notice Date and Amount	Description of the Immovable property	Reserve Price (RP)	Earliest Money Deposit (EMD) (10% of RP)
(Loan Agreement No. LXSUR004/16-17002021/ Surat Branch) ROHITKUMAR VALBHAI BHAI THUMMAR (Borrower) RASVANTI ROHITBHAI THUMMAR (Co-Borrower)	24-03-2018 for Rs. 288095/- (Rupees Two Lakh Eighty Thousand Five Only)	Plot No. 219, Shradha Residency, Kulsad, Near Kim Fakal, Block No. 739, Olda Surat - 394227 Gujarat	Rs. 80000/- (Rupees Eight Lakh Only)	Rs. 8000/- (Rupees Eight Thousand Only)
(Loan Agreement No. LXSUR004/16-17002072/ Surat Branch) JAYSUKHBAHAI MANJIBHAI BED (Borrower) JATIN JAYSUKHBAHAI BED (Co-Borrower)	14-08-2018 for Rs. 149925/- (Rupees Fourteen Lakh Eighty Nine Thousand Two Hundred Twenty Five Only)	Plot No. 220, Shradha Residency, Near Kim Fakal, Block No. 739, Olda Surat, Near Kim Fakal, Surat, Gujarat 394110	Rs. 80000/- (Rupees Eight Lakh Only)	Rs. 8000/- (Rupees Eight Thousand Only)

1. Last Date of Submission of Sealed Bid/Offer in the prescribed tender forms along with EMD and KYC is 14-09-2020 within 11:00 AM on the Auction Date mentioned herein above. Tenders that are not filed up or tenders received beyond this date will be considered as invalid tender and shall accordingly be rejected. No interest shall be paid on the EMD.

2. Date of Opening of the Bid/Offer (Auction Date) for Property is 14-09-2020 at the above mentioned branch office address at 3:00 PM to 4:00 PM. The tender will be opened in the presence of the Authorized Officer.

3. Date of inspection of the Immovable Property to be 20-08-2020 between 11:30 AM to 04:00 PM.

4. Further interest will be charged as applicable, as per the Loan Agreement on the amount outstanding in the notice and incidental expenses, costs, etc. is due and payable till its realization.

5. The notice is hereby given to the Borrower(s) and Guarantor(s), to remain present personally at the time of sale and they can bring the intending buyers/purchasers for purchasing the immovable property as described herein above, as per the particulars of Terms and Conditions of Sale.

6. The Borrower(s)/Guarantor(s) are hereby given 30 DAYS SALE NOTICE UNDER THE SARFAESI ACT, 2002 to pay the sum mentioned above before the date of Auction failing which the immovable property will be auctioned and balance, if any, will be recovered with interest and costs. If the Borrower pays the amount due to Aspire Home Finance Corporation Ltd., in full before the date of sale, auction is liable to be stopped.

7. The detail terms and conditions of the auction sale are incorporated in the prescribed tender form, Tender forms are available at the above mentioned Branch office.

8. The immovable properties will be sold to the highest tenderer. However, the Authorized Officer reserves the absolute discretion to allow inter se bidding, if deemed necessary. The Property as mentioned will not be sold below Reserve Price.

9. The Authorized Officer is not bound to accept highest bid offer and the Authorized Officer has the absolute rights to accept or reject any or all offers of the bid at any point of time and also has the right to adjourn/postpone/cancel the auction sale or conduct the auction without assigning any reasons therefor.

10. AHFC is not responsible for any liabilities whatsoever pending upon the property as mentioned above. The Property shall be auctioned on "As Is What Is Basis", "As Is What Is Basis" and "Whatever There Is Basis".

11. The Total Loan Outstanding amount is not the loan foreclosure amount. All other charges (if any) shall be calculated at the time of closure of the loan.

12. The Demand Draft Should be made in favor of "Aspire Home Finance Corporation Limited" Only.

13. The same has been published in our portal - <https://motilaloswal.com/eauction-pdf>

For further details, contact the Authorized Officer at the above mentioned Office address.

Date : 12-08-2020
Place : Gujarat
Authorized Officer
For Aspire Home Finance Corporation Ltd.

BEFORE THE NATIONAL COMPANY LAW TRIBUNAL
AHMEDABAD BENCH
CA (CAA) NO. 35 of 2020
In the matter of the Companies Act, 2013;
AND
In the matter of Sections 230 to 232 and other applicable provisions of the Companies Act, 2013;
AND
In the matter of Scheme of Arrangement involving transfer and vesting of the Cable Business Undertaking of Torrent Power Limited to TCL Cables Private Limited.

TORRENT POWER LIMITED
(CIN L31200GJ2004PLC044068)
A company incorporated under the Companies Act, 1956, and having its registered office at "Samanvay", 600 Tapovan, Ambawadi, Ahmedabad-380015 in the state of Gujarat.....Applicant Transferor Company

NOTICE OF MEETINGS OF EQUITY SHAREHOLDERS, SECURED CREDITORS OF TORRENT POWER LIMITED AND UNSECURED CREDITORS OF ONLY THE CABLE BUSINESS UNDERTAKING OF TORRENT POWER LIMITED, THE APPLICANT TRANSFEROR COMPANY.

NOTICE is hereby given that by Orders dated July 21, 2020 and June 30, 2020 (collectively referred to as "Orders"), the Hon'ble National Company Law Tribunal, Ahmedabad Bench ("NCLT") has directed separate meetings of all Equity Shareholders and Secured Creditors of Torrent Power Limited ("the Applicant Transferor Company" or "the Company") and Unsecured Creditors of only the Cable Business Undertaking ("Unsecured Creditors") of the Applicant Transferor Company for the purpose of considering, and if thought fit, approving, the Scheme of Arrangement involving transfer and vesting of the Cable Business Undertaking of Applicant Transferor Company to TCL Cables Private Limited ("Transferee Company" or "TCPL").

In pursuance of the said Orders read with general circular issued by Ministry of Corporate Affairs ("MCA") viz. circular no. 14 of 2020 dated April 08, 2020, circular no. 17 of 2020 dated April 13, 2020 and circular no. 20 of 2020 dated May 05, 2020 (collectively referred to as "MCA Circulars"), further notice is hereby given that meetings of all Equity Shareholders, Secured Creditors and Unsecured Creditors of the Applicant Transferor Company will be held through Video Conferencing ("VC") or Other Audio Visual Means ("OAVM") without the physical presence at common venue, as under:

Sr. No	Class of Meetings	Date of Meetings	Time (IST)
1.	Equity Shareholders	Tuesday, September 15, 2020	9.30 am
2.	Unsecured Creditors		11.00 am
3.	Secured Creditors		2.00 pm

Copies of the said Scheme of Arrangement, Explanatory Statement pursuant to Section 102 read with Sections 230 to 232 of the Companies Act, 2013 ("the Act") can be obtained free of charge from the registered office of the Applicant Transferor Company and / or from the office of the Advocate Mrs. Swati Soparkar at 301, Shivahik 10, Opp. SBI Zonal Office, Near Exchowk Chowky, S.M. Road, Ahmedabad 380015, Gujarat during normal business hours (9:30 am to 6:30 pm) from Monday to Friday upon and including the date of the meeting. Pursuant to the said Orders read with MCA Circulars, voting at the above meetings shall not be permitted through proxies.

NCLT has appointed Shri Mahesh C. Gupta, an independent practicing Company Secretary and failing him Shri Ullas Shah, Chartered Accountant, to act as the Chairman of the said meetings including any adjournment thereof.

The Scheme of Arrangement, if approved in the aforesaid meetings, will be subject to the subsequent approval of other regulatory authorities and sanction by NCLT.

FURTHER NOTICE is hereby given that:

- Pursuant to NCLT Orders read with MCA Circulars and provisions of Section 108 of the Act read with Rule 20 of the Companies (Management and Administration) Rules, 2014 and Regulation 44 of the SEBI (Listing Obligations and Disclosure Requirements) Regulations, 2015 the business as set out in notices for aforesaid meetings be transacted through e-voting means by way of remote e-voting facility and e-voting facility during the meetings. The Company is providing facility for remote e-voting and e-voting during the meeting through Central Depository Services (India) Limited ("CDSL"). The necessary instructions for remote e-voting and e-voting during meetings have been set out in the notices dated July 27, 2020. This facility is being provided to the Equity Shareholders holding shares in physical and dematerialised form, Secured Creditors and Unsecured Creditors, as on cut-off date i.e. September 08, 2020.
- Notice of the aforesaid meetings inter alia including the Explanatory Statement, e-voting instructions and login credentials, wherever applicable has been emailed to the Equity Shareholders, Secured and Unsecured Creditors of Applicant Transferor Company as on March 31, 2020 and June 30, 2020, whose email addresses are registered with the Company or with the Depository Participants, as the case may be. For Equity Shareholders, Secured and Unsecured Creditors who have not registered their email addresses with the Company, physical copies have been sent by courier at their registered addresses.
- The aforesaid Notices alongwith the requisite documents are also available on the website of the Applicant Transferor Company at www.torrentpower.com, websites of the Stock Exchanges i.e. BSE Limited and National Stock Exchange of India Limited at www.bseindia.com and www.nseindia.com respectively and on the website of CDSL at www.evotingindia.com.
- Equity Shareholders, Secured and Unsecured Creditors who have not registered their email addresses with the Company / Depository Participants, may follow the process detailed below for registration of their email address:

E-mail address registration process for Equity Shareholders

Physical Holding	By following the below link, Equity Shareholders may register his / her email address, mobile number and bank details https://linkintime.co.in/EmailReg/Email_Register.html After that Equity Shareholders have to fill the relevant details in the respective fields and attach self attested copy of PAN, address proof / share certificate and cancelled cheque leaf.
Demat Holding	By following the below link, Equity Shareholders may register his / her email address and mobile number https://linkintime.co.in/EmailReg/Email_Register.html For registration of bank details Shareholders are requested to visit their respective Depository Participants.

E-mail address registration process for Secured and Unsecured Creditors

Creditors may request for email registration alongwith their name, address, mobile number, PAN, Amount due from the Company at cs@torrentpower.com .

- For the aforesaid meetings of Equity Shareholders, Secured and Unsecured Creditors, the remote e-voting commences on Friday, September 11, 2020 at 9:00 am (IST) and shall end on Monday, September 14, 2020 at 5:00 pm (IST). Thereafter, remote e-voting module shall be disabled by CDSL.
- The voting right of Equity Shareholders shall be in proportion to value of fully paid equity shares of the Applicant Transferor Company held by them as on September 08, 2020 being the cut-off date.
- The voting rights as well as value of vote of the Secured and Unsecured Creditors shall be in proportion to outstanding amount due to them by the Applicant Transferor Company as on September 08, 2020 being the cut-off date.
- Any person who becomes a Shareholder / Secured and Unsecured Creditors of the Applicant Transferor Company after dispatch of the Notice and holds shares / have outstanding due to them by Applicant Transferor Company as on the cut-off date may cast their votes by following the instructions of remote e-voting and e-voting during the meeting provided in the Notice. Login credentials for voting and attending the meeting through VC / OAVM will be sent separately to those Secured and Unsecured Creditors whose names are appearing in books of the Applicant Transferor Company as on cut-off date and to whom the same has not been sent earlier. Creditors who have not received login credentials may contact Company at cs@torrentpower.com or call +91 79 26628300.
- Those Equity Shareholders / Secured and Unsecured Creditors, who will be present in the meeting through VC / OAVM facility and had not casted their votes through remote e-voting and are otherwise not barred from doing so, shall be eligible to vote through e-voting system available during the meetings.
- Shareholder / Secured and Unsecured Creditors may attend the meetings even after exercising their right to vote through remote e-voting but cannot vote again during the meetings.
- As per NCLT Orders, M/s. Rajesh Parekh & Co., a Practicing Company Secretaries have been appointed as the Scrutinizer to scrutinize e-voting during the meetings and through remote e-voting in a fair and transparent manner. The Scrutinizer will make a consolidated Scrutinizer's Report of the total votes cast in favour and against the resolution and invalid votes, if any, to the Chairman of the meeting, in writing, who shall countersign the same.
- The results of the meeting alongwith Scrutinizer's Report would be displayed at the Registered Office of the Applicant Transferor Company and on its website at www.torrentpower.com, on the website of the stock exchanges where the Applicant Transferor Company's securities are listed and on the website of CDSL.
- In case of any grievance connected with remote e-voting and e-voting during the meeting, the Equity Shareholders, Secured and Unsecured Creditors may contact Raksh Dalvi-022-23058542, Nitin Kunder - 022-23058738 and Mehboob Ikhani - 022-23058543 or send an email to helpdesk.evoting@cdsindia.com or call 1800225533.
- In order to express their views and to seek explanations pertaining to Scheme of Arrangement during the meeting, the concerned Shareholder, Secured and Unsecured Creditors are requested to register themselves as Speaker atleast 7 days prior to meetings by sending their name, email id, mobile number, DP Id and Client Id / Folio no. at cs@torrentpower.com.

Mahesh C Gupta
FCS: 2047
CP No: 1028
Chairman appointed for the Meetings

Place : Ahmedabad
Date : August 11, 2020

